



ONE BKC, 13th Floor, 1302, B-Wing Plot No. C-66, G-Block, Bandra Kurla Complex, Bandra (E) Mumbai-400051 Tel.: 6693 0813 / 0830 • Email : lplho@laffanspetrochemical.com

Date: June 7, 2021

To,

The Department of Corporate Services,

BSE Limited,

Phiroze Jeejeebhoy Tower, Dalal Street, Fort

Mumbai - 400001.

Script Code: 524522

Dear Sir/Madam,

Sub: Submission of Newspaper Publication of Extracts of Audited Financial Results (standalone)

for the quarter and year ended on March 31, 2021

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements)Regulations, 2015, we are hereby submitting newspaper publication of Extracts of Audited Financial Results (Standalone) for the quarter & year ended on March 31, 2021, as published in the Below-mentioned Newspapers.

No.	Newspapers	Page No.	Language	Date of Advertisement
1	Free Press Journal	On 15 th Page	English	-
2	Desh-Pardesh ni Aaj-kal	On 3 rd Page	Gujarati For Registered office	June 5,2021
3	Navshakti	On 11 th Page	Marathi For Corporate office	:

Kindly acknowledge, the receipt and take note same on record

Thanking you, Yours faithfully

For LAFPANS PETROCHEMICALS LIMITED

Sandeep Seth

Managing Director

(DIN: 00316075) Place: Mumbai

E-Procurement Tender Notice (IT No. 625,626 , 827 & 628 /TC-T/CGRRDA/2021, Superintending Engineer (Tender Call), CGRRDA, Raipur on NI Fig. 65, 569, 569 / 5 Febr. 10 - Fig. 1444-04 ACM - Fig. 20 - March 20 - M

S. No.	NIT No	Work Name	Amount (Rs. in Lakhs)	Districts	Rate invited
-01	625	Construction 8 maintenance of PMGSY Balance work	Total Cost (including 5 year maint. Cost.) Rs 650.14 Lakhs	Bijapur, Dantewada, Sukma	percentage Rate SOR 04.02.2016 issued by GE, GGRRDA Raipur
02	626	Construction 8 maintenance of PMGSY Balance work	Total Cost (Including 5 year maint. Cost.) Rs 1502.71 Lakhs	Danlewada, sukma	percentage Flate SOR 2005, 2003, 2016, 2008, 2006 issued by CE, CGRRDA Ralpur
03	627	Providing & Supplying The Necessary Equipments for Mobile Van	Probable amount for supply Rs 86.65 Lakhs	_	item rate tender
04	628	PMGSY Delect Liability	Total Cost Rs 20.40 Lakhs	Surguja	percentage Rate SOR 22.02.2018 issued by CE, CGRRDA Raipur

Sdf-Superintending Engineer (Tender Cell) Chhattisgarh Rural Road Development Agency Civil Lines, Raipur (C.G.) E-mail: pmgsyrc4@yahoo.co.in

90 asianpaints Asian Paints Limited CIN: L24220MH1845PLC004598 Rogd. Office: 6A, Shaniinagar Santacruz (East), Mumbal – 400 055 Tel. No.: (022) 62/81 900

NOTICE OF THE 75™ ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the 75° Annual General Meeting (AGM) of Asian Paints Limited (the Company) will be held on Tusaday, 25° June, 2621 at 11.08 an. IST through Yedoc Conference (VC) or OtherAudio Vousi Means (CAMA), to transact the businesses, as set out in the Notice convenig the 75° AGM of the Company. The venue of the meeting shell be deemed to be the Registered Office of the Company at 64. Shartmagad, Sanatacuz (Eagl.), klumbla 140.005 klumbla 14

6.4. Shankinagar, Santacuz (East), Maimbai - 400.055.
10. accordance with the General Circuisr Nos. 2020.202, 14,0020, 17,2020, 02202° issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular no. SEBIM-DOCHOM DICHEP/202079 and SEBIM-DOCFOI CMD ZICHEP/202079 and SEBIM-DOCFOI CMD ZICHEP/202079 and SEBIM-DOCFOI of India (hereinafter collectively referred to as "the Circulars"), the AGM of the Company Will be held through UC or OAVM.
The Notice convening the 75" AGM and the Integrated Annual Report for the financial year 2020-21 has been electronically sent to all the standholders whose email addresses are registered with the Company of Depocition Pericipant(s).

- for the financial year 2020-21 has been electronically sent to all the shareholders whose omal addresses are registrored with the Company of Depolicyl Pericipant(g).

 1. Pursuant to provisions of Section 108 and other applicable provisions in days of the Companies Act, 2013 and other applicable provisions in days of the Companies Act, 2013 and with Rule 20 of the Companies (Authority of the Companies Act, 2013 and Win Rule 20 of the Companies (Authority of Administration) Rules, 2014, and Repulsion 44 of 65EH [Listing rand with Rule 20 pleased to provide the facility of 16EH [Listing to the shareholders, to exercice their right to vote on the resolutions proposed to be passed at the AGM. The facility of casting votes by the members using an electronic voting system and for participating in the 75" AGM through VC/OAVM facility along with e-Voting during the AGM will be provided by National Securities Depository Limited (NSDL).

 1. The member a visiting and commences on Thursday, 24" June, 2021 at 50.00 a.m. IST and will and on Monday, 28" June, 2021 at 50.00 a.m. IST and will and on Monday, 28" June, 2021 at 50.00 a.m. IST and will and on Monday, 28" June, 2021 at 50.00 a.m. IST and will send on Monday, 26" June, 2021 at 50.00 a.m. IST and will send on Monday, 26" June, 2021 at 50.00 a.m. IST and will send on Monday, 26" June, 2021 at 50.00 a.m. IST and will send on Monday, 26" June, 2021 at 50.00 a.m. IST and will send on Monday, 26" June, 2021 at 50.00 a.m. IST and will send on Monday, 26" June, 2021 at 50.00 a.m. IST and will send to the send of the Monday and the Companies of the Province of the Monday and the Companies of the Province of the Prov

- the process to be adopted for obtaining the USER ID and Password for casting the vote.

 The manner of voting remotely or during the AGM for the removement of the process of the process of the control mode and for shareholders who have not registered their email addresses has been provided in the Notice anovering the AGM. Instructions for attending the AGM through VCIOAVM are also provided in the Notice and the AGM. Members who have cast their vote through remote e-Voting can participate in the 75° AGM but shall not be entitled to cast their vote again.
- vote again.

 In case of any queries relating to voting by electronic means, please refer the Frequently Asked Questions (FAC9) for strateholders and the «Voting user manual for shareholders available at the download section of https://www.secting.nedi.com or call on toll free on 1500 102 00901500 224 430 or send a request at www.secting.nedi.com or call on toll free on 1500 102 00901500 224 430 or send a request at www.secting.nedi.com or send a request at www.secting.nedi.com or send a request at <a href="https://www.secting.nedi.com or with Amagen (NSL). Trade Voted, "Young, "Floor, Kamala Mila Command Co

The Notice of the 75 AGM and Annual Report for the Financial Year 2020-21 along with further details are available on the whoste of the Stock Exchange, SSE Limited (www.tseindic.acm) and National Stock Exchange of India Limited (www.sseindic.acm), on the Company's website (www.tseindic.acm) and cent the website of National Securities Depository Limited at (www.acving.natio.com).

company's westel (www.asiappaints.com) and on the website of Nuironal Sociation Depository Intelled at (www.asiappaints.com). Shareholders holding shares in physicial mode and who have not updated their email address with the Company are requested to update their email address by sending a duly signed request letter to the Registra and Transfer Agents of the Company, Mis TSR Dursham Consultants Private Limited (TSR) by providing the Folio No. and name of shareholder. Abhreholders holding shares in Generalization does are requested to update/negister their email addresses with the relevant Depository Participant(s). Alternatively, you may register your email address with TSR on the temporary basis for ensure the record of Annual Repost of the Company for the financial year 2002 of 15 yealing the first. https://fspa.limitentime.com/cmimiteng/mail_Register.thml.

The relevant documents personning to the lams of business to be interested and comments of the company of the financial year 2002 of 15 to short the company of the financial year 2002 of 15 to which the first hops. Hospitalister. And the company of the financial year 2002 of 15 to his hops the company of the financial year 2002 of 15 to his the state of the company of the financial year. The providence of the prov

Investion/cellations/Basiananints.com for inspection of the said documents.

The Board of Directors at their fleeing held on Westersday, 12 May, 2021 have considered and recommended payment of final dividend of Rs. 14.50 (Rupees fourteen and paise fifty only) (final dividend) per equity share of floe value of Re. 1 (Rupee ene) each for the financial year ended 31 Manth, 2021, subject to approval of shareholders in the ensuing 75 AGM for determining the eligibility of the payment of final dividend, if approved would be paid to the eligible shareholders on or after Friday, 2 "May, 2021. The final dividend, if approved would be paid to the eligible shareholders on or after Friday 2" why, 2021. The same rim which the shareholders who wish to register their bank mandates for treaking their dividends are destined in the Nucleot of the AGM.

Shareholders may refer the Company's communication in relation to TDS on dividend payment during the FY 2021-22 and related Fermis-Declarations thereto on the Company's website at this subsequences.

For and on behalf of ASIAN PAINTS LIMITED

Date: 4"June, 2021 Place: Mumbai R J JEYAMURUGAN GFO & COMPANY SECRETARY

PUBLIC NOTICE
TO WHOMSDEVER IT MAY CONCERN
This is no inform the General Public is
BRAIN CLAMITED braining its Resistance of Information
2 A 2411, CEREAL THIMMAY'S ROAL
CANTONMENT, PUBE — 411001 tegistem
in the narry of the following Shareholder, have been ton't by them.

ben less by them.

Si No.: 1.

Name of the Sharehalder:
Smt. PUSHPA DEVDAS ADVANI

Mr. ASHOK DAYAL ADVANI Folio No.: 00923798

Fallo No. 200323799

Certificate onc. 5179399

Distinctivenous: Teledot7734 - 184027933

No of States 1100

The Public ser benefit couldnote applient mechanises and enables and the solven selected applient mechanises and enables in any new arith the solven selected these certificates and the solven selected the selected threat entities and selected threat selected the selected threat selected th

Place: Nambal Smit, RESREA DEVIAS ADEL Dave: 05/06/2021 G.Mr. ASHAN DAVAL ADEL

All Concerned

having interest

All Concerned having interest.
This is to Inform' Anotice you that my Clant MR. (ARISH PREM) DEDNIHA, wish to sale below mentioned Flat premises to (1) MRS. SWAPHALI DEVESH JADHAW, (2) MR. DEVESH JADHAW, (2) MR. DEVESH MAHESH JADHAW, (2) MR. DEVESH MAHESH JADHAW, (1) MR. DEVESH MAHESH JADHAW, Indian Service of the Consense of the Control of the Cont

Severee, wumbai 4000105. Sd/-Adv. Sujata Ravindra Babar Add: 26, Gourtaj Building, 221, Dr. B. A. Road, Hindmata, Dadar (E), Mumbai 400 014

PUBLIC NOTICE

Notice is hereby given to all that lients are intending to purcha from MFs. Pharma Trucy Partnership Firm Through Partners (1) Mrs. Jaya Aji Bhim 2) Mrs. Cihlaya Tushar Bhimani a) Mr. Kush Tushar Bhimani a) Mr. Kush Tushar Bhimani e lile Owners of Commerce Premises being Office No. 308 ha 3rd Floor, in the building kno ha 3rd Floor, in the building kno

and the Owners of Commercial Premissics being (Gits No. 300 on 1987). Premission for the Commercial Premission of the Commercial Pre

Cell: 9821161302

PUBLIC NOTICE

NOTICE is hereby given to all the members of A Little World Private Limited (CIN U31100MH2000 World Private Limited (CIN U31100MH2000 PTC147117) that the company is intending to hold its 21st Annual General Meeting through video conferencing or other audio visual means on 25th June, 2021, in compliance with applicable provisions of the Companies Act read with the McA General Circular No. 14/20/20, 17/20/20, 20/20/20 and 02/20/21 and for the said purpose it proposes to send notices to all its members by email.

cmail. Those members, who, earlier, have not registered their EMAIL ID with the company or want to update their email id, are hereby requested to register their respective EMAIL ID with the Company within 3 days from the date of publication of this notice by sending an email on the following official email Id of the Company: cs@alittleworld.com
While sending email to the company's official email das a foresaid, members need to mention his/ner Name, Folio NoIDP/client Id or attach soft copy of the share certificate or mention share certificate no. for identification purpose.
For any further queries member can contact on this

Dated: 05.06.2021 Place: Navi Mumbai

By order of the Board of Directors For A Little World Private Limited Sd/-Lokenath Panda Director DIN 00784736

PUBLIC NOTICE

NOTICE is hereby given to all the members of Zero Mass Private Limited (CIN U74599MH2007 PTC168756) that the company is intending to hold its 14th Annual General Meeting through video conferencing or other audio visual means on 25th June, 2021, in compliance with applicable provisions of the Companies Act, 2013 read with the MCA General Circular No. 14/2020, 17/2020, 20/2020 and 02/2021 and for the said purpose, it proposes to send notices to all its members by email.

all its members by email.

Those members, who, earlier, have not registered their EMAIL ID with the company or want to update their email id, are hereby requested to register their respective EMAIL ID with the Company within 3 days from the date of publication of this notice by sending an email on the following official email id of the Company: cs@zeromass.in While sending email to the company's official email id as aforesaid, members need to mention his/her Name, Folio NoIDP/Client Id or attach soft copy of the share certificate or mention share certificate no. for identification purpose.

For any further queries member can contact on this number: 022 27814411

Dated: 05.06.2021 Place: Navi Mumbai

By order of the Board of Directors For Zero Mass Private Limited Sd/-Lokanath Panda Whole Time Director DIN 00784736

GOVERNMENT OF MAHARASHTRA PUBLIC WORKS DIVISION (EAST) NASHIK E-TENDER NOTICE NO. 05 FOR 2021-2022

E-TENDER NOTICE NO. 05 FOR 2021-2022 [ONLINE] Itst Call Call Continue Tenders in B-1 form for the works included in detail tender notice are invited by Executive Engineer, P. W. Division (East) Nashik Bhandhkam Bhavan Premises Tirmbak Road Tal. Dist. Nashik Phone No 0253-231734 for and on behalf of Governor of Maharashira State from Registered Contractors in appropriate class [Registered with Public Works Department only] with Government of Maharashira. Tender Notice and Tender Documents are also available on our website https://munahanders.govin, Right of Rejection of E-Tender Sergies, Perference in Served by the Executive Engineer, P. W. Division, (East) Nashik, Conditional Tender will not be accepted.

accepted

accepted.

E-Tender Notice including Total 03 (three) works below 150.00 Lakh. Details of mentioned E Tender Notice available on below websites

1) www.mahapwd.com 2) https://mahatenders.gov.in

i) iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii	~)p		go.u.go.u
Tender Document Sale Start and End Date Time	08/06/2021 From 11:00 Hrs	То	22/06/2021 Upto 17:00 Hrs
The state of the s			The property was a second

Note
1, E-Tender Fee (non refundable) and Earnest Money will be accepted online only.

2. All eligible/ intrested Contractors are required to be enroll on portal https://mahatenders.gov.in before downloading tender documents and participate in etendering

3. Bid Capacity is applicable for all works. Please Note this to all Registered Contractors

Sd/-Executive Engineer Public Works Divistern (East) Nashik DGIPR 2021-22/730



SLUM REHABILITATION AUTHORITY

No. SRA/Dv. Coll./Maruti Darshan/L.A./21/ 20651

Date: 04-June-2021

PUBLIC NOTICE

It is informed that Manuti Darshan CHS (Prop.), Architect and Developer has made a combined application for acquisition of the area concerned to the society under section 14 (1) of the Maharashtra Sum Areas (Improvement, Clearance and Redevelopment) Act, 1971. The applicant has submitted the property documents. Accordinally the nontrinulars of grant proposed to be declared are as under.

Sr No.	Village & Taluka Name	C.T.S. No.	Area as per Property Card (sq. mtrs)	Area To be Acquired (sq. mtrs)	Owner
(1)	(2)	(3)	(4)	(5)	(6)
1	Village	409	218.90	218.90	Bhogilal Jagjivandas Mestry
2	Kanheri Taluka Borivali	409/1 To 30	296.50	296.50	Bhogilal Jagjivandas Mestry Imla Owner - Mr. Rampyare S. Dubey
		-	F4F 40	F4F 10	

515.40 Total 514.40 5154.40 5154.40 Land owners or anybody who claims to have any right, title or interest (if any) is having any objection in respect of the proposed acquisition of the aforesaid property may submit written objection to Sium Rehabilitation Authority within a period of 30 days from the date of publication of this Notice.

Note: Due to area difference, present public notice is published in place of previously published public notice bearing No SRA/Dy. Coll./L.A./C.S.No.69/2018/2019/10235, Dated. 26/02/2018

(SATISH LOKHANDE) CHIEF EXECUTIVE OFFICER
SLUM REHABILITATION AUTHORITY

strative Building,Prof. Anant Kanekar Marg, Bondra(East), Mumbai-400051 Tel No.: 022-26565800; Fax: 91-22-26590457. Email: Info@sra.covin

PUBLIC NOTICE

Commercial Premises admeasuring 1280.15 sq. ft. Carpet area on Ground Fision & Basement admeasuring 137.4 4 square feet Carpet area (Totally admeasuring 1755.59 sq. ft. Carpet area), "RAMANI VILLA" building, first road, TPS-IV, Bandra West, Mumbai 400050, situate, on land bearing Plot No. 118, C.T.S., No. F9317, Village Bandra, Taluka Bandra & District Mumbai. ollowing share certificate of INDUSIND IANK LIMITED baying its Registered office (2401, GENERAL THIMMAYYA ROAD, ANTONMENT, PUNE 411041 registered I the marine of the following Sharehnider)

CANDONANT, PARK — 41 1011 replaced in a comparation of the principle of the comparation of the principle of the comparation of the principle of the comparation of th um non some certificate/s til and odge soch claim with the Campany or its Registra and Innside Agent LINK BITMER INDIA PRIVATE LIMITED C-101 247 PARK E. S. MARIO INTERBOLI WEST MUMBAI-LOODST within 15 days of publicabins of Juli notice after which no darm will be extentained and the company shall proceed to ksoe Duplicate flare Certificated.

C.T.S. No. F9317, Village Bahndra, Taluka Bahndra & District Mumbai.

This is to notify the public at large that, we are investigating the tille of the owner in respect of the immovable property referred herein above. My client, intends to take on Lease basis the schedule property from its owner. Sml. Gopi Kishanchand Ramani, Mr. Kishanchand Khazanchand Ramani & M. Surall Kishanchand Ramani. Aly persona. Bank, Institution having any objection, claim, right, title or intensit in respect of the schedule property for its FSI for TLRI) in the way of safe, gift exchange, lease, lenancy, licenter, microgage, lien, charge, trust inheritance, assement, development rights, order/decreed judgment of any Court, option agreement or any kind of Agreement or otherwise whilastower of any nature in respect of the schedule property are called upon to lodge their objections with supporting documents with Filtern (15) days from the date of publication of this notice with the undersigned, falling which my client shall proceed to deal with the owners of the schedule property and no claims shall be entertained thereafter. Advocate: Uday Agashe Advocate High Court ddress: 1004, Siddheshwar, Heights, Patil Wadi, Thane (W)-400 601

HEM HOLDINGS AND TRADING LIMITED

					1	Rs. in Lakhs
		1	Quarter Ende		Yeart	
Sr. No.	Particulars	31.03.2021	31,12,2020	31,03,2020	31.03.2021	31.03.2020
NO.		Unaudited	Unaudited	Unaudited	Audited	Audited
1	Total Income from Operations	4.06	0.00	24.77	4.66	36.18
2	Net Profit/(Loss) from operations before exceptional					
7	items and tax	2.26	(172)	17.77	-6.23	19.52
3	Net Profit/(Loss) before tax	2.26	(1.72)	17.77	-6.23	19.52
4	Net Profiti(Loss) for the period after tax	2.26	(1.72)	14,58	-6,23	16.33
5	Total Comprehensive Income for the period					
	(Comprising Profit/(Loss) and other		1			
	Comprehensive income for the periodi	0.63	(1.25)	16.56	-8.99	1.92
6		24	24.00	24.00	24	24.00
1	(Face Value of the Share shall be indicated)	10	10.00	10.00	10	10.00
7	Earnings Per Share of Rs 10/- each	1.0	12.00	(185097A)	2000	2000
1	(not annualised):			and a		
	a) Basic	0.94	(0.72)	5.08	-2.6	6.80
	b) Diluted	0.94	(0.72)	5.08	-2.6	6.80

he debided format of Quarterly Financial Results flied with the Stock Enchanges under Regulation 20 of the and Disclosure Regulatements | Regulations, 2015 | The flif format of the Justicely Financial Results are range website weekbendie accome and on the Company website wew.memindefings and range website weekbendie accome and on the Company website website with emindefined severed by Acti Committee in its meeting helder of 2d a land 2021 and approved by the Board of Execution in a. 2021 and the United Review of the same has been carried only the Acti Allasse.

For, Hem Holdings and Trading Ltd

(Sangeeta Kelan Sh

Director DIN-05322039

AN ISO 9002 CO.

Regd. Office: Shed No. C1B/316 GIDC,
Panoli, Ankleshwar, Dist. Bharuch Gujrat.

Particulars	and Committee	Quarter E	nded	. Yea	rended
	31.03.21	31.12.20	31.03.20	31.03.2021	31.03.2020
Total Income from Operations (Net)	538.24	450.51	286.00	1,679.61	1,218.36
Net Profit/(Loss) from ordinary activities after tax	(235.25)	250.63		335.30	(396.02)
Net Profit/(Loss) for the period after tax (after extra ordinary items)	(235.25)	250.63	(488.42)	335.30	(396.02)
Total Comprehensive Income for the period after tax	(235.29)	250.59	(488.35)	335.14	(396 18)
(Comprising Profit/(Loss) for the period after tax & other Comprehensive Income after Tax Equity Share Capital	800.00	800.00	800.00	800.00	800.00
Roservo excluding Revoluction Reserve às per Balance Sheet of Previous accounting year	800.00	850.00	000.00	000.00	500.00
Earning Per Share of Rs. 10/- each	1 8		107-109	10000	000000
(a) Basic and diluted EPS before Extraordinary items	(2.94)	3.13		4.19	(4.95)
(b) Basic and diluted EPS after Extraordinary items	(2.94)	3.13	(6.10)	4.19	(4.95)

:
The above Audited results for the quarter and year ended 31st March, 2021 have been received by the Audit committee
and approved by the Board of Directors at its meeting held on 03 mJ Jun, 2021.
The Provincian countries as achities has only one primary reportable segment i.e. in trading of chemicals and

commodities. The financial results of the Company have been prepared in accordance with the Indian According Standards (NID AS) as notified by Ministry of Corporate Affairs parametr to Section 133 of the Companies Act 2013 read with rule 3 of the Companies (and accounting Standards) amendment rules as 100 man of the companies (and accounting Standards) amendment rules 2016 and it terms of regulation 33 of the SER (ILSTER) obligations are Disclosure Requirements (Regilations, 2015. SER) (Contardards (1919)) SER, 2016 and its terms of regulation (1919) SER (1919) SER

Place :- Mumbal Date :- 03/06/2021

Laffans

Sandeep Seth

JAI CORP LIMITED

Regd, Office: A-3, MIDC Industrial Area, Nanded - 4: CIN: L17120A+11885PLC038506 Phone: (022) 6115 5300 - Fax: (022) 2257 5197 - Website: www.jaicorpinda.co

EXTRACT OF STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIALS RESULTS
FOR THE QUARTER AND YEAR ENDED 31" MARCH 2021

			Standalone			Consolidated	1
Sr. No.	Particulars	Quarter Ended 31.03.2021	Year Ended 31.03.2021	Quarter Ended 31.03,2020	Quarter Ended 31,03,2021	Year Ended 31,03,2021	Quarter Ended 31.03.7020
1	Total Income from Operations from Continuing Operations	13,735	56,194	11,815	14,188	58,035	12.318
2	Net Profit/(Loss) for the period/year (before Tax, Exceptional and/or Extraordinary items) from Continuing and Discontinuing Operations	1,381	12,801	751	1,921	13,044	636
3	Net Profit/(Loss) for the period/year before tax (after Exceptional and/or Extraordinary items/Associates) from Continuing and Discontinuing Operations	1,381	12,801	751	1,921	13,044	636
4	Net Profit/(Loss) for the period/year after tax (after Exceptional and/or Extraordinary Items/Associates) from Continuing and Discentinuing Operations	965	9,861	392	1,415	9,276	287
5	Total Comprehensive Income for the period/year (Comprising Profit/(Loss) for the period/year (after tax) and Other Comprehensive Income (after tax))	977	9,778	431	1,409	9,424	437
6	Equity Share Capital	1,785	1,785	1,785	1,785	1,785	1.785
7	Earnings Per Share (of Re. 1/- each) (for continuing and discontinued operations) - Basic & Diluted	0.54	5.52	0.22	0.79	5.20	0.15
8	Other Equity excluding Revaluation Reserve	-	1				

me above is an extract of the detailed format of Quorterly and Yearly Financial Results flect with the Stock Excitanges Regulation of the SERI (Listing and Other Dipdoseur Regulationers), Regulations, 2015 now with SERI crustler of 2010.The full farmed to the Quarterly and Hearly Financial Results are valiable on the website of the Stock Test BEE Limited (www.besindia.com) and National Stock Exchange of India Limited (www.reser.ida.com) and the Conference of the Conference of

(eww.)sicoprind.com)

Chailed Option respect by Independent Auditors on Consolidated Financial Results:

(i) The consolidated financial results also include the Group's other of net profit after tace (Rs. 75 Lakh & Rs. 15 Lakh and strail

ii) The consolidated financial insteads also include the Group's other of net profit after tace (Rs. 75 Lakh & Rs. 15 Lakh and strail

comprehende Inspired in Rs. 82 Lakh fire Rs. 22 Lakh fire the quarter and year ended 31" March A22" respectively,

as considered in the consolidated financial insteads in respect of an associals, whose financial instements have not been

suited. The consolidated financial insteads of the subscience of the subscience in the reports on the consolidated financial insteads

their report on the consolidated results and was also qualified by the auditors in their reports on the consolidated financial insteads in their report in their reports on the consolidated financial insteads in their compared properties and which the subscidium's principal instead in their consolidated of the comparing barries in endirely are which are evoluted in seasons along any is of the Verw that the advance excluded and commitment from the promoter of those parties and hence no provision for impairment is required against the above receivables. The subscious compared in the consolidated ensures and was also qualified by the auditors in their reports on the consolidated of muculal statements and results.

For and on Behalf of the Board

Sd/-Gaurav Jain Managing Director (DIN 00077770) Place : Mumbai Date : 4*June, 2021

બે દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્ટોલ-કીઝલના ભાવમાં થયો ભડકો

રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે ૯૧.૫૭ રૂપિયા પર તો ડીઝલની કિંમત ૯૨.૦૯ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી

રાજકોટ

બે દિવસના વિરામ બાદ આજે કરી પૈટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થયો પેટોલમાં પ્રતિ લિટરે ૨૬ પૈસાને થયા છે. જ્યારે ડિઝલના ભાવમાં પતિ લિટરે ૩૦ પૈસાનો વધારો ઘયો છે નવા ભાવ વધારા સાથે આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે ૯૧.૮૦ રૂપિયા પર પહોંચી. જયારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે ૯૨.૨૯ સ્વિયા પર પહોંચી છે. ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ

લિટરે ૯૨ રુપિયા. જયારે ડિઝલની કિંમત ૯૨.૪૯ રુપિયા પર પહોંચી છે. રાજકોટમાં પૈટોલની કિંમત પ્રતિ લિટરે ૯૨.૦૯ સ્વિયા પ્રતિ લિટરે પતોંચી વડોદરામાં પેટ્રોલની પ્રતિ લિટ-૯૧.૪૭ સ્વિયા જ્યારે ડિઝલ પ્રતિ



જામનગરમાં પેટોલની કિંમત પ્રતિ લિટરે ૯૧.૭૨ સ્વપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે ૯૨.૨૨ રુપિયા પર પહોંચી છે. જૂનાગઢમાં પેટ્રોલ પ્રતિ લિટરે ૯૨.૪૦ રુપિયા વેંચાય રહ્યું છે. જયારે ડિઝલ ૯૨.૯૧ રુપિયા પ્રતિ લિટરે વેંચાઈ રહ્યું છે. સુરતમાં પેટ્રોલની પ્રતિ

ડિઝલની ફિંમત ૯૨.3 સ્વપિયા પ્રતિ લિટરે પહોંચી છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે ૯૩.૩૭ સ્વિયા જ્યારે ડિઝલ પ્રતિ લિટરે ૯૩.૮૫

રુપિયા વેચાઈ રહ્યું છે. મે મહિનાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કુડ ઓઈલના કંપનીઓએ પેટ્રેલ-ડિઝલના ભાવમાં ૧૬ વખત વધારો કર્યો હતો. તો બીજી તરફ અનેક રાજ્યમાં લોકડાઉનના કારણે તેની માગમાં ૧૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. હવે કિઝલ પણ

૧૦૦ રનપિયા તરફ

દેશમાં સૌથી મોં શું પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મળી રહ્યું છે જ્યાં ૧૦૫.૮૦ રૂપિયા પ્રતિ લિટર ભાવ છે. જ્યારે ડિઝલ ૯૮.૬૩ રુપિયા પ્રતિ લિટર છે. જો એવામાં ભાવ વધી રહ્યા છે તો આવનારા થોડાંક જ દિવસોમાં અહીં પેટ્રોલ પણ ૧૦૦ રુપિયા પ્રતિ લિટર થઇ જશે. મંબઇમાં પેટ્રોલનો ભાવ ૧૦૧ રુપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ચુકયો છે. જ્યારે ડિઝલ ૯૩ રુપિયાની નજીક વેચાઇ

मे महिनामां ४.०६ રુપિયા પેટ્રોલ મોં<mark>ઘુ થયું</mark> મેં મહિનામાં પેટ્રોલ-ડિઝલના

ભાવમાં ૧૬ વખત વધારો થયો. જ મેથી સતત ૪ દિવસ સુધી ભાવમાં વધારો થયો જ્યારે ચૂંટણીના લીધે તેની પહેલાં ૧૮ દિવસ સુધી ભાવમાં કોઇ વધ-ઘટ જોવા મળી નહોતી. મે મહિનાના અંતમાં દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર ૪.૦૯ રુપિયા અને ડિઝલ ૪.૬૮ રુપિયા મોંઘ થયું.

૨૦૨૧માં પેટ્રોલ ૧૧ અપિયાથી વધુ મોંઘુ થયુ ૨૦૨૧માં અત્યાર સુધીમાં ઈંધણના ભાવ ૪૪ વખત વધ્યા છે.

ખા દરમ્યાન પેટ્રોલ ૧૧.૦૫ રુપિયા પ્રતિ લિટર મોં ઘું થયું છે. ૧ જાન્યુઆરીના રોજ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૮૩.૭૧ રુપિયા હતો આજે ૯૪.૭૬ રુપિયા છે. આવી જ રીતે દિલ્હીમાં ૧ જાન્યુઆરીના રોજ ડિઝલનો ભાવ ૭૩.૮૭ હતો જે આજે ૮૫.૬૬ રુપિયા છે. આમ ૧૧.૭૯ રુપિયાનો વધારો નોંધાયો છે.

સરકારી વાહનો રદખાતલ જાહેર થયા ખાદ ૯૦ દિવસમાં નિકાલ કરજિયાત

સરકારી વાહનનું આયુષ્ય ૨.૫ લાખ કિ.મી.: ટાયરનું આયુષ્ય ૪૦હજાર કિ.મી: સંબંધિત વહીવટી વિભાગના વડા વાહન રદબાતલ કરવાની મંજૂરી આપી શકરો

આજકાલ પ્રતિનિધિ

ગાંદીનગર

ગુજરાત સરકાર દ્વારા વાહન કંડમ જાહેર કરવા તેમજ તેના નિકાલ માટે વર્ષ ૨૦૧૮ માં કમિટીની રચના કરી <mark>હતી .આ</mark> સમિતિએ ૨૦૧૯ માં પોતાની પોલીસી બનાવી અને સસ્કારને આપી હતી, જેના આધારે રાજ્યમાં વાહન રદબાતલ જાહેર કરવા માટે ગઈકાલે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ એ કેટલાક મહત્વનાં નિર્ણયો જાહેર કર્યા છે .જેમાં વાહન ટાયર અને વાહનના નિકાલ માટેના નિયમો આખરી કરવામાં આવ્યા છે. વાહન કંડમ થઈ ગયા પછી ૯૦ દિવસમાં નિકાલ કરવો કરજીયાત કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે રાજ્યનાં સરકારી વાહનોને રદ કરવાના ધારા ધોરણોમાં ફેરફાર કર્યા છે.હવેથી સરકારી વાહનો ૧૦ વર્ષ જુના અને ૨.૫ લાખ કિમી ચાલ્યા હશે તો સ્દબાતલ ગણાશે. આ અંગે રાજ્યના બંદરો અને વાહનવ્યવહાર વિભાગે નિયમોમાં ફેરફાર કરવા તેમ જ ટાયરોની આયુષ્યમર્યાદા વધારવા નિર્ણય કર્યો છે.

હાલમાં અદ્યતન ટેકનોલોજીવાળા વાહનો બજારમાં ઉપલબ્ધ છે. સાથે રાજયમાં રસ્તાઓની સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. આ બાબતોને ધ્યાનમાં લઈને સરકા-આ નિર્ણય લીધો.

નિર્ણય પ્રમાણ હવ સરકારી વાહનોની ૨ લાખ કિ.મી.ના બદલે ૨.૫૦ લાખ કિ.મી. ચાલી હોય તેમ જ ખરીદીના ૧૦ વર્ષ પૂર્ણ કર્યા હશે તેવા વાહનને જ કચેરીના વડા રદબાતલ કરી શકશે. ઉપરાંત ટાયરોનું આવખ્ય ૩૨ હજાર કિલોમીટરના સ્થાને ૪૦ હજાર કરવામાં આવ્યં.

સરકારી વાહનોની લઘુત્તમ આયુષ્યમયદામાં કેરકાર કરવા તેમ જ તેને રદબાતલ કરવા અંગેના ધોરણોમ हेरहार हरवा जाजते तथा शयरानं . આયુષ્યમયદાના માયદંડોમાં ઉચિત વધારો કરવા અંગ ૧૩-૪-૨૦૧૮ના રોજ રાજયના વાદનવ્યવહાર

કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.

समितिએ २३-८-२०१७न રોજ સૂચનો અને ભલામણ સાથેનો અહેવાલ સરકારમાં રજૂ કર્યો હતો. તે ભલામણો અંગે સરકારે વિચારણાં હાથ ધરી હતી. વિચારમાંના અંત રાજ્યના વાતનવ્યવહાર વિભાગ આજે નિર્ણય

આ સિવાયના વાહન રદબાતલ કરવા માટે અર્થાત ૨.૫૦ લાખ કિ.મી. અને ખરીદીના ૧૦ વર્ષ પરા કર્યા ન હોય તેવા વાહનોને રદબાતલ કરવાની જરુરિયાત ઊભી ધાય તો નર્મદા જળ સંપત્તિ વિભાગ અથવા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના યાંત્રિક વિભાગન અધિક્ષક ઇજનેરનો અભિપ્રાય મેળવીને સંબંધિત વહીવટી વિભાગના વડા વાહન રદબાતલ કરવાની મંજુરી આપી શકશે

કોઇપણ વાહન સ્ટબાતલ જાહે કર્યા બાદ તેનો વધુમાં વધુ ૯૦ દિવસમ નિકાલ કરવાના રહેશ તેવા પણ નિર્ણય

૧૩૪ કિલોના આઇપીએસ ઓફિસર કોરોનાના ત્રીજા વેવની સંભાવના અને અનુમાનો સામે આઠ મહિનામાં ૪૩ કિલોના થઇ ગયા ગુજરાતની સજજતાની વિસ્તૃત સમીક્ષા કરતા મુખ્યમંત્રી

મધ્યપ્રદેશના પોલીસ અધિકારીનું અનુકરણ કરીને ગુજરાતના પોલીસના વિડીચો કોન્ફરન્સના માધ્યમથી **પાંચ મહાન**ારોના મ્યુનિસિપલ કમિશનર્સ અને વરિષ્ઠ ઓવરવેઇટ ઓફિસરો તેમજ કર્મચારીઓ પણ ફિટ થઇ શકે છે

આજકાલ પ્રતિનિધિ ગાંદીનગર

મધ્યપ્રદેશના એક આઇપીએસ ઓફિસર દેશ અને ગુજરાતના એવા પોલીસ ઓફિસરો માટે મિસાલ બન્યાં છે કે જેમનું શારીરિક વજન ૧૦૦ કિલોગામ કે તેનાથી વધુ છે. આ ઓફિસરે માત્ર આદ મહિનામાં કોઇપણ મેડિસીન કે જીમના પ્રયોગ વિના ૪૩ કિલોગ્રામ ાજન ઉતાર્યું છે. તેઓનું વજન ૧૩૪ કિલોગ્રામ હતું. આ કામ તેમણે નેશનલ પોલીસ એંકેડેમીમાં કર્યું છે.

મધ્યપ્રદેશના આઇપીએસ વિવેક રાજસિંહ કુકરેલે પોલીસ એકેડેમીમાં જોડાયા હતા. તેમણે કઠોર ટ્રેનિંગ પછી વજન ઉતાર્ય છે. સોશ્યલ મિડીયા પ્લેટફોર્મના માધ્યમથી આ ઓફિસરે બીજા અધિકારીઓ અનુકરણ કરે તે ઘટેલા વજન સાથેના ફોટોગ્રાફ મૂક્યાં

તેમણે વજન ઉતારવા માટે શું કર્યું તે ફેસબુક પોસ્ટ પર મૂક્યું છે. તેમણે લખ્યું છે કે મને મહેસૂસ થતું હ**તું** કે



છેલા કેટલાક વર્ષોથી ઓવરવેઇટના કારણે મુશ્કેલી પેદા થતી હતી. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી હતી. વજન વધતાં બ્લડપ્રેશરની બિમારી શરૂ થઇ હતી પરંતુ એકેડેમીમાં વજન ઉતારવા માટે મને મોટી ઉપલબ્ધી મળી છે. વોકિંગની સાથે હું કસરત પણ કરતો

. તેમણે લખ્યું છે કે છેલા કેટલાક

વર્ષીમાં નોકરી દરમ્યાન મારું વજન વયામાં નોકરા દરમ્યાન માસ્ત્ર વજન ૧૩૮ કિલોગ્રામ થઇ ગયું હતું. હું ખાવાનો શોખિત છું. હું માનું છું કે ખોરાકને ફેંકી દેવો ન જોઈએ. આ મારું આદર્શ વાક્ય છે. સમય વિના ખાવાનું અને પેટ ભરીને જમતો હોવાથી મારું વજન વધી રહ્યું હતું. વજન ઉતારવા માટે મેં વોકિંગ શરૂ કર્યું હતું જેના કારણે વજનમાં ઘટાડો થયો છે. એ ઉપરાંત પ્રોપર ડાયટનું પણ પાલન કર્યું છે. મારું વજન ઉતરતાં મારું બ્લડપ્રેશર નોર્મલ છે અને મારી રેસ્ટિંગ પલ્સ રેટ ૪૦ બીપીએમ છે.

ગુજરાતના પોલીસ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં જે પોલીસ અધિકારી કે કર્મચારીઓ ઓવરવેઇટ છે અને જેમનું વજન વધારે છે તેઓએ મધ્યપ્રદેશના આ પોલીસ ઓફિસર જેવું કઠીન કાર્ય કરવું જોઇએ રાજ્યમાં પોલીસ એક્રેડેમી છે ત્યારે તેનો લાભ લઇને પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ કીટ રહેવું હિતાવહ છે કે જેથી તેઓ બમણાં જુસ્સાથી કામ કરી શકે.

આજકાલ પ્રતિનિધિ ગાંધીનગર

ગાધાનગર કોરોના સંક્રમણના ત્રીજા વેવની સંભાવના સામે રાજ્ય સરકારની સદજાની મુખ્યમંત્રી વિજયભાઈ સ્ત્ર્યાણીએ આજે विस्तत समीक्षा क्ष्मी हती. होरोनानी होर કમિટીની બેઠક દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પાંચ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડીયો કોન્કરન્સના માધ્યમથી વાત કરીને વર્તમાન આરોગ્ય સુવિધાઓ અને ભવિષ્યની જરવરિયાતને પહોંચી વળવાના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી.અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરના યુનિસિપલ કમિશનર્સ તથા એવા વરિષ્ઠ અધિકારીઓ કે જેમણે કોરોનાના સંક્રમણના પહેલા અને બીજા વેવ દરમિયાન નોંધપાત્ર કરજ બજાવી છે એવા અધિકારીઓ સાથે વિસ્તૃત વિચારવિમર્શ કરાયો. કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે આપણે સ્ટેજ પણ નિશ્ચિંત રહેવાનું નથી. ગુજરાતે સાવધાન અને સજાગ રહેવાનું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા આવદવક એવા તમા**મ**



છે. દરેક વ્યક્તિએ સંયમ જાળવવાનો છે અને એ રીતે સ્વસ્થ રહેવાનું છે. જેથી આપણે ત્રીજા વેવને ટાળી શકીએ, આમ છતાં રાજ્ય સરકાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રતિબન્દ અને પ્રયત્નશીલ છે. દેશના અને દુનિયાના નિષ્ણાતો કોરોનાના સંક્રમણના બીજા વેવ પછી ત્રીજા વેવની સંભાવના અને અનુમાનો કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ સ્વપાણીએ ગુજરાતમાં હોસ્પિટલ બેડની સંખ્યા, ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની ઉપલબ્ધિ, ઓક્સિજન વ્યવસ્થા, દવાઓ અને ઈન્જેક્શનની આવશ્યકતા અને ઉપલબ્ધિ જેવા તમામ વિષયો પર વિસ્તૃત વિગતો મેળવી હતી. તેમણે દરેક મહાનગરના મ્યુનિસિપલ કમિશનર્સ અને અધિકારીઓ

સાથે સીધો સંવાદ કરીને કોરોનાના સંક્રમણના પહેલા અને બીજા તબક્કાના અનુભવો જાણીને ત્રીજા તબક્કા વિશેના ત્રેમના અનુમાનો તથા આયોજનોની ન્યુત્વા પાલું કરા કરા કરા કરો તેમના અનુમાનો તથા આયોજનોની વિગતવાર માહિતી મેળવીને જરૂરી આદેશો આપ્યા હતા.અત્રે એ ઉલેખનીય છે કે.

અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોર કમિટીનો સીધો સંવાદ સામે ઘણા સમય પહેલાંથી જરુદી આવોજ અને વ્યવસ્થા શરુ કરી છે. મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અંગ્ર સચિવ કે. કેલાસનાધન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં

વાજાવલી કાર કમિટીની બદકમાં હાજર હતા આ ઉપરાત અધિક મુખ્ય નોધિવ પેકળકુમાર, મનોજકુમાર દાસ, આરાવ્ય અન્ન સચિવ ડો શ્રીમતી જવેતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, આરોગ્લ કમિશનર જવપડકા શિવહરે, અને હારિત શુક્લ ઉપસ્થિત રહ્યા

તા.૧૦મી જૂને કંકણાકૃતિ સૂર્ચગ્ર

કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયામાં કંકણાકૃતિ, ઉ.અમેરિકા, યુરોપ, એરિયામાં ખંડગ્રાસ, પૃથ્વી ઉપર પાંચ કલાકનો અદ્ભૂત અવકાશી નજારો, નરી આંખે જોવું નુકસાનકારક

આજકાલ કાર્યાલય

રાજકોટ

વર્ષ ૨૦૨૧નું ભારતનું આખરી સૂર્યગ્રહણ તા.૧૦મી જૂન ગુરુવારે અવકાશી ખગોળિય ઘટના બનવાની છે. વિશ્વના દેશો અને પ્રદેશોમાં કંકણાકૃતિ વિશ્વના દેશા અને પ્રધ્યાના ૦૦૬ઘટુંઘડ અને ખંડગ્રાસ સૂર્વગ્રહણનો પાંચ કલાકનો અદ્દભૂત અવકાશી નજારો નિહાળવા જળરી ઉત્કંઠા છે. ભારતમાં ૧૦મી જૂન, તા.૧૯મી નવેમ્બર અને તા.૪ ડિસેમ્બરનું ગ્રહણ જોવા મળવાનું નથી. ઉ.કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયામાં કંકણાકૃતિ જ્યારે ઉત્તર અમેરિકાના ઉત્તર ભાગમાં, યુરોપ, એશિયામાં ખેડગ્રાસ ગ્રહણનો નજારો બનવાનો છે. સવંત ૨૦૭૭ વૈશાખ વદ અમાસ ગુરુવાર તા.૧૦મી જૂન-૨૦૨૧ના રોજ મગશિર્ષનકાત્ર અને



વૃષભ રાશિમાં ધનાડું કંકણાકૃતિ-ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં કર્યાય જોવા મળશે નહીં જ્યારે આ અદ્દભ્ત ગ્રહણ ઉ.કનેડા, ગ્રીનલેન્ડ, રશિયામાં કેકણાકૃતિ જ્યારે ઉ.અમેરિકાના ઉત્તર ભાગમાં, યુરાપ એશિયામાં ખંડગ્રાસ સૂર્યગ્રહણનો નજાર જોવા મળવાનો છે. સૂર્યગ્રહણ નરી આંધ જોવું અતિ જોખમકારક છે. કંકણાકૃતિ જાવું આતે જાળનકારક છે. કેક્કુનફુટા અવકાશી ઘટનાના પ્રદેશોમાં વૈજ્ઞાનિકા, ખગોળપ્રેમીઓએ જગ્યા નિશ્ચિત કરી લીધી છે. જખરી ઉત્કંદા તૈયારીઓ જોવા

મળે છે. ભારતના લોકો સંપૂર્ણ વૈચિત રહેવાના છે. હવે પછી તા ૧૯મી નવેમ્બરે રહવાના છે. હવે પછા તો પટમાં નવસ્થત ગ્રસ્તો દય સ્થિતિમાં અને તા. ૪ ડિસેમ્બરની અવકાશી ઘટના પણ ભારતના લોકોને નિરાશા મળવાની છે તેથી વર્ષ ૨૦૨૧નું ભારતનું આ આખરી ગ્રહણ કહી શકાય.

ભારતીય સમય મુજબ ભૂમંડલ ગ્રહ્મુ સ્પર્શઃ ૧૩ કલાક ૪૨ મિનિટ ૨૨ સેકેન્ડ, ગ્રહ્મુ સંમીલનઃ ૧૫ કલાક ૧૯ મિનિટ ૫૩ સેકન્ડ, ગ્રહણ મધ્યા ૧૬ કલાક ૧૧ મિનિટ ૫૭ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલના ૧૭ કલાક ૦૩ મિનિટ જ૮ સેકન્ડ, ગ્રહણ મોકા: ૧૮ કલાક ૪૧ મિનિટ ૨૨ સંકન્ડ, પરમગ્રાસ: ૦.૯૪૩ ભૂમંડલ ગ્રહણની અવધિ પાંચ કલાક સુધી

Rs. 100/- per cc

પગલાં લેવાના છે. નિયમોને અનસરવાન डोरोनाना पणतां पाएी જિલામાં કેસોની સંખ્યા એક આંકડામાં

ખૂખજ ઝડપથી કેસો ઘટતા જશે અને જૂનના અંત સુધીમાં દૈનિક કેસોની સંખ્યા ૨૦૦ થી ૩૦૦ની વચ્ચે રહેવા સંભવ છે

Laffans



આજકાલ પ્રતિનિધિ

ગુજરાતમાંથી કોરોના સંક્રમણના વળતાં પાણી થઇ રહ્યાં છે. તબીબોન મતે જનના અંત સધીમાં દૈનિક કેસોની સંખ્યા ૨૦૦ થી ૩૦૦ની રહેવા સંભવ છે. રાજ્યના ૧૨ એવા જિલ્લા છે કે જ્યાં કેસોની દૈનિક સંખ્યા ઘટીને એક અંકમાં આવી ગઇ છે. રાજ્યમાં બીજી લહેર ખતમ થવાના આરે છે

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કેસોની સંખ્યા ૧૦૦૦ થી ૧૨૦૦ની વચ્ચે રહી છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે, જ્યારે રિકવરી રેટ ઉંચો આવ્યો છે. સંરેરાશ ૩૦૦૦ થી ૪૦૦૦ લોકો સાજા થઇ રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૯૮૯૦ જેટલા દર્દીઓના મોત થયાં છે જયારે ૭.૭૮ લાખ લોકો રિકરવ

બન્યાં છે. કોરોનાના દૈનિક આંકડા ખત્યારે સરકાર અને લોકોને રાહત અપાવી રહ્યો છે.

ગુજરાતની વસતી ૧.૫૦ કરોડ છે જે પૈકી અત્યાર સુધીમાં ૧.૭૧ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે એક દિવસમાં વૈક્સિન લેનારા લોકોની દૈનિક સંખ્યા ૧ ૩૫ લાખ જેટલી ઘઇ છે. રાજ્યના મુખ્ય શહેરો કે જ્યાં ફોરોના કેસોની સંખ્યા વધારે જોવા મળે છે ત્યાં વેકિસનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. સરકારનું પ્લાનિંગ છે કે જુનના અંત સદીમાં ૨.૨૫ કરોડ લોકોને

વેકિસન આપી દેવામાં આવે. ગુજરાતમાં ત્રણ ડિજીટમાં કોરોનાના કેસો જોવા મળ્યા છે તેવા શહેરોમાં અમદાવાદ અને વડોદરા છે જ્યારે સુરત અને રાજકોટમાં કેસોની સંખ્યા ઘટી છે. જામનગર, જૂનાગઢે અને ભાવનગરમાં પણ કેસોની સંખ્યામાં કેસો ઘટતા જાય છે. રાજ્યના ઘટાડો થયો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોના કેસો ઘટીને ૧૦ થયાં છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં

ભાવનગર, તાપી, દાહોદ, દ્વારકા, અમદાવાદ, બોટાદ, ડાંગ, ગાંધીનગર, નર્મદા, પાટણ, છોટાઉદેપુર, મોરબી

અને સુરેન્દ્રનગર એવા જિલ્લા છે કે જ્યાં કેસોની સંખ્યા સિંગલ ડિજીટમાં આવી છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોના સમાપ્ત થવાના આરે છે.

					1
Panoli	. Office: Sh , Ankleshw 92PLC018626 We	ed No ar, Dis	t. Bha	316 G ruch C petrochen	Bujrat.
Particulars		Quarter E	nded	Yea	t enced
	31.63.21	31.12.28	31.03.20	31,03,2021	31.03.2020
otal Income from Operations (Net) Ext Profit/ (Loss) from ordinary activities after tax fet Profit/ (Loss) for the period after tax after axts ordinary items)	538,24 (235,25) (235,25)	250,63	286.00 (488.42) (468.42)		1,216.36 (398.02) (396.02)
utal Comprehensive Income for the period after tax	(235.29)	250.59	(488.35)	335.14	(396.18)
Comprising Profit/(Loss) for the period after tax & other iomprehensive income after fax quity Shane Capital ioserve excluding Revaluation Reserve as per alonce Sheet of Provious accounting year arring Fer Shane of Rs. (307- each	800.00	800,00	500,00	800.00	800.00
(a) Basic and diluted EPS before Extraordinary Boms (b) Basic and diluted EPS after Extraordinary Items	(2.94) (2.94)	3.13 3.13	(6.10) (6.10)	4.19 4.19	(4.95) (4.95)
ote:					

rany have been prepared in accordance with twi are Affairs pursuant to Section 133 of the Con Standards) rules. 2015, Companies (Indian Ac Companies (Indian Accordance)



RATE (Percc) Individual E	Edition(IP)
RAJKOT	Rs. 150/- per cc
Jamnagar	Rs. 140/- per cc
Bhavnagar	Rs. 70/- per cc
Porbandar	Rs. 70/- per cc

	•			
nedabad	Rajkot	Jamnagar	Bhavnagar	Porbandar
799 18199	99798 50585	98250 73588	98795 42542	77788 11110

या दवारे किरो साम प्रायद्धे लिगिटेडच्या (कं.ओ. क. : U74999MH2007PTC168756) सर्व सदस्यांना सचना देण्यात देशकी, दिश्विओ औत्पर्यत्मियाद्वारे किंवा दूतर शीडिओ दिल्युआत माध्यमाद्वारे आपत्मी १४ वी वाशिक संक्षेपाराण सभा दिलांक २५ जुन, २०१२ रोजी घेण्याचा कंपनीचा विचार आहे, तर हि सभा एमार्गि (MCA) अतरस्त परिपक्षक कमात ४५/२०२० १७/२०२ २०/२०२० आणि ०२/२०२१ सह वायतेत्वा कंपनाचार्या कायद्वार्यात्ने कामु तर्दादीच्या अनुष्माने आहे आणि त्या उदेशोंने मार्थ सदस्यांना ईनीस्टबर्स नोटीस पाठविष्याचा प्रस्ताव आहे.

संव संदर्भागां प्रमादवंत मादास पाठावण्याचा प्रस्ताव आह. ज्या सदस्यांची पापूर्वी कंपनीक्ष्ठे आपता है नेता आयडी नोंटणी केला नसेत किवा त्यांचा हैमेल आयडी अद्वयावत कराया। असेत त्यांचा या नोंटीसच्या प्रकाशाच्या तार्हणासून ३ दिवसांच्या आत कंपनीला आपता संबंधित ईमेल पत्ना नोंदवावा अशी वितंती आहेत्दरा कंपनीच्या वालील अपियुन ईमेल आयडीवर ईमेल करून नोंदवावा ca@zercmass.in

आस्त्रावर इनल करन तादावा cs@zeromassin उपरोक्त प्रमाणं कंपनीच्या अधिकृत ईनेल आयडीवर ईनेल पाठवत अस्ताना सदस्यांनी त्याचे शिरो मात, फोलिओ इनाक / डीपी / क्लायंट आयडी नमृद्र करणे आवश्यक आहे किंवा होशर प्रमाणपावाची सांग्य कांपी किंवा होशर प्रमाणपाय इनाक नमृद् करणे आवश्यक आहे, आळड हेत्साठी.

कोणत्याही प्रश्नांसाठी सदस्य या क्रमांकावर संपर्क साथ शकतातः ·2236648844

संचालक मंडळाच्या आदेशानुसार झिरो मास प्रायव्हेट तिमिटेड साठी सही श्री. लोकनाथ पंडा संपूर्ण वैळ संचालक संचालक अळिक क्रमांक: ०७७८४७३६

फॉर्म आचएतसी −२६ कंपन्यांचे (समावेशन) नियम, २०५४ च्या नियम ३० मा अनुसाल एका राज्यादन अन्य राज्यांत नॉदणीकुन क्रायांलय हत्त्वच्यासाढी प्रतीपार प्रकारित कारायाची जादियात प्रकारत करायपाचा जाहरात फेंद्र सरकार, क्षेत्रीय संचालक, पश्चिम क्षेत्र, मुंबई समोर

स्वम, २०१३ च्या कलम १३ थ्या पोट-कलम (४) आणि कंपनांचे । २०१४ च्या नियम ३० च्या पोट-नियम (५) च्या खंड (ए) च्या खंड

आण एम के द्वीन ऑटोपार्ट्स प्रायच्छेट स्थिपेटेड, ज्यांचे बॉटगीमूल कार्यालय आहे- प्लॉट प्र. ए-१९, त्रकेमाय इंडाट्रीचल परिया, गाय क्यलापुर्वेचे, ता. मायळ, पुणे-४१०५०७,

जाहीर सूचना शर्वधानाम् बन्देता बाहरे शुक्त त्यांत त्यांत वेतं की, बेक्सेशा विश्व नंतर्गामूना वार्यास्य "महाराष्ट्र सरम्बाह्न तर्गाग्रक्ताह्न राज्यांने "महत्त्वने शरून यहाँ कामू २७ में, २०११ रोजी झाहेत्या विश्वी अध्यानात्र सर्वेश स्वारंत्र्याने नित्र प्रतास्त्र नित्र वेतंत्र केरसीयम मेंबीहरूम अधिकारम प्रता मेरबहरण मंत्रुर्ते गिवाणसाहो संस्त्रा अर्धार्मियम्, २०१३ च्या सम्बर १३ अपने अर्थ सरसाधा संपरीक्षा

प्रकार कर कि प्रकार के प्

विकासः पुणे एमके ट्रॉन ऑटोपार्टम प्रावदेर स्तिनदेश नाटी दिनांकः ०५.०१.२०२१ पुरुपसाध पुरुपेसन – संचालकः (श्रीआधर्गः ०७४१२२२२)

यूनियन बैंक 🕼 Union Bank

%== C==

यसई पूर्व शासा दुबान क्र. १९ आनि २०, अग्रावाल नगरी, वगर्द फोन क्र. (०२५०-२९५०९००)

मागणी सूचना

कता १५ (१) महावादा सार्याची अंग्रह, २००२ च्या कत्व १६(३) अववं र्वक प्राचन १६ (१) महावादा सार्याची अंग्रह, २००२ च्या कार्य स्थान प्राचन व्यवस्था स्थान स्था

फर्नदार आणि रपीदागधे नाय	मिलफनीचे वर्णन
पसीट का. YaY, Yधा मजला, बी बिंग, फैलाश दर्शन विलिड्ड का. १ सील्यन्स लि.,	पर्नेट क. १०८, दमा भवता, की सिंग, कैसारा दर्गन विभिन्ने क. १ शीएचएम सि., अण्डापुरी रोड, सत्तरसंख्या पूर्व, चुना कर्चे क्र. १५ आणि १६०, नीवन सर्वे क्र. १३२ आणि १३८ पर्नाटक २०, ११, १६०, २८ काणि ११, चट्टे केंत्र ४३ ५५ ची नीटर्म, नाव अपनेले, सात्त्वक सर्महे, विकास वासाय—४०१२०६
३१/०३/२०२१ रोजीस ह. १८.२८.२१२/-	सचना तारीख ०४/०५/२०२१

अन्यास्त्र , सामा व्यवस्था । अन्यस्था । अन्यस्य । अन्यस्था । अन्यस्यास्त्र । अन्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्था । अन्यस्यस्था । अन्यस्था । अन्यस

दिनांक : ०५/०६/२०२१ ठिकान : बसई

सरी/-प्राधिकृत अधिकारी युनियन बैंक ऑफ इंडिया

स्थायर मिळकतीचे वर्णन	राखीय कियत	इसारा अनामत
(तारणपद्या)	(राकि)	रक्रम (रुपवात)
पूर्व जा अर्थन क्षत्र प्रशासना करियाक विकास व्यवस्था अर्थन विकास व्यवस्था अर्थन विकास वि	₹. ₹, 24, 02,000/-	To,bo,oco/-

प्राधिकृत अधिकारी इनकार अगेट मिकन्युक्तान कंपनी प्रापसेट मिनिटेड

महाराष्ट्र औद्योगिक विकास महामंडळ (महाराष्ट्र शासन अंगिकृत)

_	ई-निविदा सूचना क्रमांक/०२/सन २०२१-२२	
अ. क्र.	कामांचे नाव	अंदाजित रक्कम रुपये
٤	पाणी पुरवठा बोजना शेंद्रा व जालना औद्योगिक क्षेत्र उदंपन केंद्र पैठण नेवे ३६ २.ल. ली. प्रतिदित क्षानेदेवाओं परिण महीतर्यना पुरवठा करन कार्योन्तिक करणे व विद्युत पुरवठा करण्यासाठी र्यात्र उपकेंद्र व अनुविभिक्त इतर कामे, उभारणे व कार्योग्वित करणे.	ह. ३१,४९,५९,९११,००
3	बाळुव औद्योगिक क्षेत्र रस्ते देखभात व दुष्टस्ती अंतर्गत रांजनगाव बळनावर आर सी सी नाली बांधकाम करणे इत्यादी.	₹. ३८,२०,१६१,००
24	वालुज मध्यवनी पानी पुरवटा बंजना देखभात व दुक्तनी उद्देवन गृह स्रम्हाण्डाण मेश्रे १६० व्हीतर, द्वीपी पॉनर सत्ताव मिस्टीमना पुरवटा करणे, उभारणे त्र कार्यानित करणे, १ ३ के जो उजदाब स्वीच गोर्ड पंतर एस.एफ. –६ क्षेकर पंतर व आरटीसीमी पंतर दुस्त्ती करणे, त्या अनुपंतरों कार्य करणे	क. ३१,०८,४३१.००
¥	बाळु - मध्यवर्शी पाणी पुरवठा योजना देखभात व दुरूस्ती जलसुद्धिकरण केंद्र वैधील एसीबी लघुदाब फैल साहित्यासह दुरूस्ती, बदलणे व इतर अनुषंगिक कामे करणे.	रु. २६,८३,०६६.००
٩	घुळे पाणी पुरवठा योजना देखभाल व दुरूस्ती जलशुद्धिकरण केंद्र येथे Detuned Reactive power compension system with reactor panel सस्यिणे च कार्यान्वित करण्याचे काम करणे.	₹. २४,२१,५३०.००
ξ	चिकत्तवाणा ओद्योगिक क्षेत्र देखमाल व दुरूस्ती अंतर्गत विश्रामगृह परिसरातील विस्तारित इमारतीचे बाँटर पुकिंग करणे व इतर किरकोळ कामे.	₹E, 99, 767.00 (
U	चिकलठाणा व औरंगाबाद ओढोगिक क्षेत्र रस्ते देखभाल व दुरूरती अंतर्गत चिकलठाणा व औरंगाबाद ओढोगिक क्षेत्रातील बगीच्याची ३ वर्षासाठी देखभाल करणे. (दुसरी मागणी)	रू. १६,९७,११०.००
۷	वाळुत ओद्योगिक क्षेत्र पाणी पुरवठा योजना देखभाल व दुरूरती अंतर्गत पोहच रस्त्यावर खाम नदीवरच्या पुलाची दुरूरती करणे इत्यादी कामे.	₹. १ ६,५७,०५०.००
8	वाळुत्र ओद्योगिक क्षेत्र रस्ते देखभात व दुरूस्ती अंतर्गतवाळुत्र ओद्योगिक क्षेत्रातील पावसाळवापूर्वीचे कामे करणे.	रु. १६,२७,९२७.००
90	वाळुन औद्यांगिक क्षेत्र अमिशमन केंद्र देखभाल व दुरूस्ती अमिशमन इमारतीच्या छताची गळती बंद करणे व इतर कामे.	3. \$4,\$2,526.00
**	बालुउ ओद्योगिक क्षेत्र रस्ते देखमाल ब हुरूस्ती अंतर्गतः मुखंद क्र. एवस-९९ ते एक्स-३१३ दक्ष्यान ९०० मी.मी. व्यासाची आर सी सी पाईप पाणी वाहुन जाण्याकोरता मोकळी जागा ग्र. १९/१ मधुन अंथरणे. (दुसरी मागणी)	४. १४,०२,९३५.००
\$5	शेंद्रा औरोोनिक क्षेत्र रेशीम अधिकारी शेणी-१ जिल्हा रेशीम कार्यात्व, औरंगाबाद यांना स्वतंत्र ५० मी.मी व्यासाची एवडीपीई जलवाहिनी पसरविण व जोडुन देणेबाबत. (भांडवसी अंशदान काम) (दुसरी मागणी)	₹. १२,०३,००६.००
१३	नाशिक/सिक्रर पाणी पुरवडा योजना देखभात व दुरूस्ती नाशिक/सिक्रर पाणी पुरवडा योजना येथे स्पेअसंसह आणि किरकोळ साहित्यासह एत टी पॅनेल्सची वार्षिक देखभात व दुरूस्त्री करणे.	४. ११,६१,६१५.००
58	अतिरिक्त तातुर औद्योगिक क्षेत्र भागी पुग्वता योजना देखभात व दुक्ती अगुद्धक्त उदंचन केंद्र धरेगाव आणि अतिरिक्त तातुर औद्योगिक क्षेत्रातील बत्तशुद्धिकाम केंद्र बेभील २१५ केव्हींग क्षेत्र द्रान्सफार्मची रिवार्चडींग आणि अगरिफ काम करणे	क. २,०६,७२५.००

ुक्तुम्बल काल मुक्तुम्बल काल मुक्तुम्बल कुन्नार क्रायदासकरूव काम ऊ. १ ते १४ वर्गाता ई निविद्य वी-१/वी-या वरित्त कामकर्ताता योग्य त्या वर्गामध्ये मोद्यांकृत कंडारदासकरूव काम ऊ. १ तरीता है - ०/०६/२२१ ते है. १/व/१०/२२१ ते मुक्तुम्बल काम ऊ. ३,८,४,५ क्यतिता है. ७०/०९/२२१ ते हैं. २२/०५/२२२ ते सीट मा ऊ. ३,४,५ कर्माता ७,१०६/२०२१ ते है. २४/०५/२०२१ सेवेच काम ऊ. ७,४,१,१२ क्यांता है. ००/०५/२२२१ ते है. १८/०६/२२१ तोच्य काम ऊ. १०,१३,१४ क्योंता है. ०८/०५/२२१ ते है. २४/०५/२०१ या दास्यात विधिय भवा वेतीतुं, याच्यासकर्ता विचित्ता मार्गाठी स्वरामध्यास्त्र काल क्यांत्र काल (औगायवाद योग) या प्रवेतास्त्रकालय

उत्तराच आहु. निविदा सुन्ता अगर निविदा सुन्तेनील कोणताही भाग कोणतीही पूर्व सुन्ता न देता रख करण्याचा अथवा राखुन ठेकण्या ततेच सुधारणा करण्याचा हरूक म.औ.चि. महामंडळाने राखुन ठेवला आहे.

PRICE/INITIAT™ IGIGI Prudential Asset Management Company Limited

Pristato Affice: 12" Floor, Naroin Manzil, 23, Barakhamba Road, New Delhi - 110 001.
Corporate Office: 0ne BKC, 13" Floor, Bandra Kurla Complex, Mumbai - 400 051.
Tel.: +91 22 652 500, Fax- +91 22 655 900, Website: www.icioiprunf.com,
Email id: enqui/v@icioiprusmc.com
Central Sarvice Office: 2" Floor, Block B-2, Miron Knowledge Park, Western Express
Highway, Goregoon [E), Mumbai - 400 063. Tel.: 022 2685 200 Fax: 022 26868313

Notice to the Investors/Unit holders of ICIGI Prudential Constant Maturity Gilt Func ICIGI Prudential Long Term Equity Fund [Tax Saving] and ICIGI Prudential Fixe Maturity Plan - Series 82 - 1141 Days Plan Y (the Schemes)

Notice is heroby given that ICICI Prudential Trust Limited, Trustee to ICICI Prudentia Mutual Fund has approved the following distribution under Income Distribution cum capital withdrawal option (IDCW option) of the Schemes, subject to availability of distributable surplus on the record date i.e on June 10, 2021:

Name of the Schemes/Plans	Quantum of IDCW (₹ per unit) (Face value of ₹ 10/- each) ^{S#}	NAV as on June 3, 2021 (₹ Per unit)					
ICICI Prudential Constant Maturity	Gilt Fund						
Quarterly IDCW	0.0969	10.8458					
Direct Plan - Quarterly IDCW	0.1073	11.0917					
ICICI Prudential Long Term Equity Fund (Tax Saving)							
IDCW	0.70	22.29					
Direct Plan - IDCW	0.70	34.31					
ICICI Prudential Fixed Maturity Plan	n - Series 82 - 1141 Days Plan Y						
Quarterly IDCW	0.0500	12.5813					
Half Yearly IDCW	0.0500	12.5812					
Direct Plan - Half Yearly IDCW	0.0500	12.6161					

- The distribution will be subject to the availability of distributable surplus and may be lower depending upon the extent of distributable surplus available on the record date under the IDCW option of the Schemes.
- # Subject to deduction of applicable statutory levy, if any

or the immediately following Business Day, if that day is a Non - Business Day, for the immediately following Business Day, if that day is a Non - Business Day, fine distribution with respect to IDCW will be done to all the unit holders/beneficial swers whose names appear in the register of unit holders/Statement of beneficial owners maintained by the Depositories, as applicable under the IDCW option of the Schemes, at the close of business hours on the record date.

It should be noted that pursuant to payment of IDCW, the NAV of the IDCW option of the Schemes would fall to the extent of payout and statutory levy (if applicable).

Suspension of trading of units of ICICI Prudential Fixed Maturity Plan - Series 82 -1141 Days Plan Y (FMP - Sr 82 - 1141D Pl YI):

The units of FMP - Sr 82 - 1141D PI Y are listed on BSE. The trading of units of FMP - Sr 82 - 1141D PI Y will be suspended on BSE with effect from closing hours of trading of June 7, 2021.

For the purposes of redemption proceeds, the record date shall be June 10, 2021

For ICICI Prudential Asset Management Company Limited Sd/-

Place : Mumbai Date : June 4, 2021 No. 004/05/2021

To know more, call 1800 222 999/1800 200 6666 or visit www.iciciprumf.com

Authorised Signatory

BSE Disclaimer: It is to be distinctly understood that the permission given by BSE Limited should not in any way be deemed or construed that the Scheme Information Document (SIO) has been cleared or approved by BSE nor does it certify the correctness or completeness of any of the contents of the SIO. The investors are activated to refer to the GID for the full text of the Disclaimer clause of the BSE Limited.

advised to refer to the BID for the full text of the Disclaimer clause of the BSE Limited.

As part of the Go Green Initiative, investors are ancouraged to register/update their e-mail id and mobile number to support paper-less communications.

To increase awareness about Mutual Funds, we regularly conduct investor Awareness Programs across the country. To know more about, it please vials throughtwouldicionum common oversit AMFI's website https://www.amfindis.com

Mutual Fund investments are subject to market risks,

read all scheme related documents carefully

ASPIRE

ॲस्पायर होम फायनान्स कॉर्पोरशन लिमिटेड

कब्जा सूचना (स्थावर मिळकन/तींकरिता)

क्षात्रकारी, विश्वकारी क्षेत्रकार है। क्षात्रकार करिया कि प्रकृति करिया है। विश्वकारी करिया है कि विश्वकार और अग्रेस्त केंद्र प्रकृति करिया है। क्षात्रकार करिया करिया करिया करिया है। १०० अग्रेस करिया है कि विश्वकार करिया है। कि विश्वकार करिया है है। १०० अग्रेस करिया है। १०० अग्रेस है। १०० अग्रेस है। १०० अग्रेस करिया है। १०० अग्रेस है। १०० अग्रेस करिया है। १०० अग्रेस है।

न कार. प्रमाण प्रमाण देखात वेदों की, वार्षण माहु शिक्षण वीति अवतात जरू में आर्थी शिक्षण वार्षण जरूनात जानेना कोण महित्रण मेंबे बतान महु सहस्रात आरोतना राज्येना आरोबित एतना, कहें कराज्युत्ता नगरामां जात आर्थी को असरोरेना विजेषण सर्वितान असरका प्रमाण के रुप गीहर-४ माहु (चक्र सनु गिर्कट के समान जाते केरण

#1	कर्म सम्बद्धः समाताः	माणवी सुत्रनंती तारील	काता प्राप्ताचा व	रहायां रिज जी और्म
	सद-मार्थेशस्ट्रसीदाः व व नाव	अप्रीय स्वन्ता	तारीक	वर्षन
	एलएक्सकेएआर००३१५-१६००१८५१० दिनेस नाउकृत्य ताड आणि दीसा दिनेस लाड	२३-१०-२०१९ जरिता ह. १४४८७००/-	24-01-3034	पर्यट क्र. ३०६, ३ र मानाः, क्रीक्सा प्रसन्, क्र. माना स्टिर क्रस्ट गांपाटा जीत रोट, स. ३. ३३४ २००१व डॉनियर्ना (४) जन मात्रा मेरिर क्रस्ट, इले

पाधिकृत अधिकारी, (अस्पायर होम काधनान्य कोपॉनसन लि.)

1 Laffans OCHEMICALS LIMITED AN ISO 9002 CO.

Regd. Office: Shed No. C1B/316 GIDC,
Panoli, Ankleshwar, Dist. Bharuch Gujrat.
9999G1/1929/L018528 Website: www.lafansetrochemical.com

Particulars	Quarter Ended			Year ended	
	31.03.21	31 12.20	31.03.20	31.03.2021	31.03.252
Total Income from Operations (Net) Net Profit/(Less) from ordinary activities after tax Net Profit/(Less) for the period after tax (after extra ordinary items)	538.24 (235.25) (235.25)	450.51 250.63 250.63	286.00 (488.42) (488.42)		1.218.30 (396.02 (396.02
Total Comprehensive Income for the period after tax	(235.20)	250.59	(488.35)	335.14	(396.18
(Comprising Profit/(Loss) for the period after tax & other Comprehensive Income after Tax Equity Share Capital Reserve excluding Revaluation Reserve as per Balanca Sheet of Provious accounting year	800.00	800,00	800.00	800.00	800.00
Earning Per Share of Rs. 10/- each (a) Basic and diluted EPS before Extraordinary Items (b) Basic and diluted EPS after Extraordinary Items	(2.94) (2.94)	3.13 3.13	(6.10) (6.10)	4.19 4.19	(4.95) (4.95)

The above Audited results for the quarter and year ended 31st March, 2021 have been received by the Audit committee and sperwed by the Board of Directors all tamenting field on 03rd Jun, 2021.

The Company current business activities has only one primary reports like segment i.e. In trading of cherndals and commodities.

commodities. The financial results of the Company have been prepared in accordance with the Indian Account in grandlands (RND AS) as notified by Millstoy of Company have been prepared in accordance with the Indian Account in grandlands (RND AS) as notified by Millstoy of Company (RND AS) as a notified by Millstoy of Companies (RnD As) as a notified by Millstoy of Companies (RnD As) and the Association o

Sandeep Seth Managing Director

हेम होल्डिंग्ज अँड ट्रेडिंग लिमिटेड

नोंद्योकृत य

						(र. माधार)	
37. W.	तपशील	अंपलेली तिपादी			संपतिले वर्ष		
		35.03.7075		35.03.7070		35.03.3070	
		अलेखापरीक्षित	अलेखापरीक्षित	अत्संसायरोक्षित	लेखापरीक्षित	सेखापरीक्षित	
	प्रवर्तनातून एकूण उत्पन्न	70.7	0.00	3Y.Wa	101	34.10	
?	अपनादारमञ्ज्ञ भागी आणि करपूर्व प्रवर्तवाहन दिस्तळ	53865	101610		11100	200000	
	त्रफा/(बंद्य)	3.35	(8:42)	\$3.55	- : 53	24.47	
1	नरपूर्व निकास नका / (बीटा)	25.5	(8.63)	ta.35	- 23	25.63	
Y	कालानभौगाठी कर्पना निकाय रका /(वीदा)	25.55	(8.40)	2115	- 23	24, 31	
4	भारतानभीसाठी एक्ष सर्वनपानेशक उत्पन्न (तथा/(तांटा) आर्थि						
	कोलानभीरमधी इतर सर्वसमानशक उत्पन्न धरून)	0.63	(4.50)	25.25	- 22	7.53	
ξ	भरमा ब्रालेने सम्भाग पांड्यत	37	27.00	37 30	18	37 25	
	(श्रेमा पे दर्शनी मृत्य दाखपर्ग)	1.		\$0.00	10	\$0.00	
b	प्रत्येकी रू. १०/- भी प्रती संग्रभाग प्राप्ती (अमार्थिक):					2000	
	ए) मृतमून	#.Ax	(0,41)	5.06	- 9.5	460	
ł.	भी) मीप्पिकृत	* 4Y	(0.01)	1.06	3.5	4.60	

તિ (તિકિટ)ન अधिकरोजमा और दिवस्तोज विकासप्रिया) प्रमुक्तिमा, २०१५ च्या शुन्तिमा ३३ अंतर्यक हाक इत्यर्थकेमाध्ये मार विकासिक प्रतिकारी विकासिक विकासिक हाका आहे. जिस्सी होतीची निकासी मेलूर्ग विकास रहीक सार्वादिको ने सार्वाद अक्क विकासी अपकोसिकोल्या कर ना उत्तर के प्रतिकारी के प्रतिकारी के स्थाप के प्रतिकारी के स्थाप के प्रतिकारी के स्थाप विकास अपकीसिकोल्या ३२, २२१ हो तीचे सार्वासा नैकरिन सुधीसिकोल के कि.

देम झोल्डिंग्ब और ट्रेडिंग लिमिटेड सा

- जड ६०६ण स्वापटक साझे सही/-(सॉपता केटन शाह) डायरेक्टर डीआराम्य - ७५३२२०३५

JAI CORP LIMITED

Rogd, Office: A-3,

a: (022) 6115 5300 • Fax: (022) 2287 5197 • Website ACT OF STATESPEN EXTRACT OF STATEMENT OF AUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIALS RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31" MARCH 2021

(Rs. in Lakh Particulars Total Income from Operations from Continuing Operations 13,736 56,194 11,815 14,188 58,035 12,318 Continuing Operations
Her Profil (Case of the periodylear obstrate)
And Profil (Case of the periodylear obstrate) And Experimental and the
Barandelmay Herry from Continuing and
Biscontinuing Operations
Her Profil (Case of the periodylear before
tar (Inter Exceptional and/or Extraordinary)
Herry Francisco
Herry Fra 1.381 12,801 1,921 13.044 636 12,801 751 1,921 13 4 965 9.861 392 1,415 9.276 287 9,778 1,409 9,424 Equity Share Capital 1.785 1.785 1.785 Earnings Per Share (of Re. 1/- each) (for continuing and discontinued oper - Basic & Diluted 0.54 5.52 0.22 0.79 5.20 0.15 Other Equity excluding Revaluation Reserv

The above is an extract of the detailed format of Quarterly and Yearly Financial Results filled with the Sloce Exchanges under Regulation of the SERIL Listing and Other Disclosure Requirements (Regulations, 2015 read with SERI clonder C "Ault, 2016). The self terms of all the Custom of the SERIL Listing and the Contract of the SERIL Listing and SERIL Listing and SERIL Listing (Seril Listing Contract) and the Company (West) (SERIL Listing Contract) (SERIL Listing Contract)

Dualited Option represently recorded Auditors on Consolidated Francial Results.

The consolidate francial results also inclinated under the product of the p

For and on 8 chalf of the Board Sdf-Gauran Jain Managing Director (DM: 00077770) Place : Mumbal Date : 4° June, 2021